

Seat No. : _____

AK-107

April-2023

B.Com., Sem.-IV

210 : Statistics

Time : 2:30 Hours]

[Max. Marks : 70]

- સૂચનાઓ :** (1) જમણી બાજુના અંકો ગુણ દર્શાવી છે.
(2) સાંકું કેલ્ક્યુલેટર વાપરી શકાશે.
(3) દરેક પ્રશ્નના સમાન ગુણ છે.

1. (a) વિકલનની વ્યાખ્યા આપો. તથા ઉપરાંત વિકલનના કોઈપણ ચાર નિયમો લખો. 6

(b) નીચેના માટે $\frac{dy}{dx}$ મેળવો : (ગમે તે ચાર) 8

(1) $y = \frac{x^3 - 5x^2 + 7x}{x}$

(2) $y = 5 \log x - \sqrt{x} + 17$

(3) $y = (3x + 5)(x^2 - 1)$

(4) $y = x^7 \cdot 5^x$

(5) $y = \frac{2x - 3}{5x + 4}$

(6) $y = \log(x^4 \cdot e^x)$

અથવા

(a) નીચેના વિધેયો માટે સાંકળના નિયમનો ઉપયોગ કરીને વિકલનક્ષણ મેળવો : (ગમે તે બે) 6

(1) $y = (x^2 - 7x + 11)^8$

(2) $y = \sqrt{x^3 - x^2 - x - 1}$

(3) $y = 5^{x^2} + 3x + 1$

(4) $y = e^{5-x+x^2}$

(b) જો $y = x^3 \cdot \log\left(\frac{1}{x}\right)$ હોય તો સાબિત કરોકે, $x \cdot \frac{dy}{dx} + x^3 - 3y = 0$. 8

2. (a) સમજાવો :

6

- (1) સીમાંત ખર્ચ
- (2) વિધેયની ન્યૂનતમ કિંમત
- (3) માંગની મૂલ્ય સાપેક્ષતા

(b) નીચેના વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવો :

8

$$f(x) = x^3 + 3x^2 - 45x + 100$$

અથવા

(a) સમજાવો :

6

- (1) દ્વિતીય વિકલન
- (2) આમદની વિધેય
- (3) ઈજારાશાહીમાં નક્ષે મહત્તમ કરવાની રીત

(b) (1) $y = e^{3x} + e^{-3x}$ હોય તો $\frac{d^2y}{dx^2} = 9y$ સાબિત કરો.

8

(2) જો માંગનું વિધેય $p = 80 - 3\sqrt{x}$ હોય તો $x = 400$ આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો.

3. (a) સૂચકાંકનો અર્થ અને ઉપયોગો જણાવો.

6

(b) નીચેની ભાહિતી પરથી લાસ્પેચર, પાશે તથા કિશરના સૂચકાંકો શોધો :

8

| વસ્તુ | 2018 | | 2020 | |
|-------|------------|-----------------|------------|-----------------|
| | ભાવ (₹) | જથ્થો (નંંબ) | ભાવ (₹) | જથ્થો (નંંબ) |
| A | 5 | 6 | 6 | 8 |
| B | 3 | 8 | 2 | 10 |
| C | 2 | 12 | 4 | 10 |
| D | 8 | 2 | 7 | 2 |
| E | 9 | 5 | 9 | 6 |

અથવા

(a) જીવન નિર્વાહનો સૂચકાંક એટલે શું ? તેની રચનાના મહત્વના મુદ્દાઓ વિશે જણાવો.

6

(b) (1) અચલ આધારે આપેલ સૂચકઅંકોને પરંપરિત આધારના સૂચકઅંકોમાં ફરવો : 8

| વર્ષ | 2011 | 2012 | 2013 | 2014 | 2015 | 2016 |
|-------------------|------|------|------|------|------|------|
| અચલ આધારે સૂચકઅંક | 100 | 120 | 125 | 140 | 175 | 200 |

(2) નીચેની માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે સૂચકઅંક શોધો :

| વસ્તુ | આધાર વર્ષ | | ચાલુ વર્ષ |
|-------|-----------|-----|-----------|
| | જ્યાદો | ભાવ | ભાવ |
| P | 50 | 12 | 15 |
| Q | 7 | 25 | 35 |
| R | 15 | 80 | 90 |
| S | 20 | 65 | 90 |
| T | 3 | 120 | 150 |

4. (a) સામાચિક શ્રેણી એટલે શું ? તેના ઉપયોગો જાણાવો. 6

(b) ત્રણ વર્ષની ચલિત સરેરાશની રીતે વલાણ તેમજ અલપકાલીન વધઘટ મેળવો. 8

| વર્ષ | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | 2010 |
|--------|------|------|------|------|------|------|------|------|------|------|
| શ્રેણી | 75 | 60 | 55 | 59 | 85 | 60 | 67 | 80 | 90 | 96 |

અથવા

(a) સામાચિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું ? તેના ઘટકો સમજાવો. 6

(b) નીચેની માહિતી પરથી મોસમી સૂચકઅંકો મેળવો : 8

| વર્ષ | જાન્યુ-ફેબ્રુ | માર્ચ-એપ્રિલ | મે-જૂન | જુલાઈ-ઓગસ્ટ | સપ્ટે.-ઓક્ટો. | નવે.-ડિસે. |
|------|---------------|--------------|--------|-------------|---------------|------------|
| 2018 | 52 | 60 | 65 | 70 | 80 | 88 |
| 2019 | 58 | 64 | 70 | 78 | 84 | 90 |
| 2020 | 60 | 65 | 74 | 80 | 89 | 94 |
| 2021 | 40 | 48 | 52 | 56 | 60 | 65 |
| 2022 | 45 | 50 | 56 | 60 | 64 | 70 |

5. માંગ્યા મુજબ જવાબ આપો : (ગમે તે સાત)

14

- (1) જો $y = a^x + e^x + a^e + e^a$ હોય તો $\frac{dy}{dx}$ શોધો.
- (2) જો $y = \log x$ હોય તો $\frac{d^2y}{dx^2}$ શોધો.
- (3) જો કુલ ખર્ચ વિધેય $C = 2x^3 + x^2 + 11x + 150$ હોય તો સીમાંત ખર્ચ તથા સરેરાશ ખર્ચ વિધેયો મેળવો.
- (4) જો $x + y = 2x - y$ હોય તો $\frac{dy}{dx}$ શોધો.
- (5) વિધેયના મહત્તમ અને ન્યૂનતમ થવા ભાટેની પર્યાપ્ત શરત જણાવો.
- (6) એક વस્તુનો ચાલુ વર્ષે ભાવ આધાર વર્ષની સરખામણીએ ત્રણ ગણો વધ્યો, તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થાય ?
- (7) ડેર્બિશ-બાઉલી તથા માર્શિલ એજવર્થના સૂચકાંકોના સૂત્ર જણાવો.
- (8) પાશે અને ડેર્બિશ-બાઉલીના સૂચકાંકો અનુક્રમે 165 અને 145 હોય તો લાસ્પેયરનો સૂચકાંક શોધો.
- (9) સામાચિક શ્રેણીના કયા ઘટક સાથે નીચેની ઘટનાઓને સંકળશો ?
 - (i) કોરોનાને લીધે ઓફિસઝનની માંગમાં થયેલ વધારો
 - (ii) રેસ્ટોરન્ટ માલિકને શાની-રવિમાં થતો વકરો
- (10) એક વર્ષના ચાર ત્રૈમાસના મોસમી સૂચકાંકો પૈકી ત્રણ 85, 110 અને 125 છે. તો ચોથા ત્રૈમાસનો સૂચકાંક શું થાય ?
- (11) મોસમી વધઘટો અને ચક્કિય વધઘટોનો આવર્તન ગાળો સામાન્ય રીતે કેટકેટલો હોય છે ?
- (12) સરેરાશ આવક, સીમાંત આવક તથા માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો.

AK-107

April-2023

B.Com., Sem.-IV**210 : Statistics****Time : 2:30 Hours]****[Max. Marks : 70]**

- Instructions :**
- (1) The figures on right side shows the marks.
 - (2) Simple calculator is allowed.
 - (3) All questions carry equal marks.

1. (a) Define the differentiation. Also write any four rules of differentiation. 6

(b) Find $\frac{dy}{dx}$ for the following : (any four) 8

(1) $y = \frac{x^3 - 5x^2 + 7x}{x}$

(2) $y = 5 \log x - \sqrt{x} + 17$

(3) $y = (3x + 5)(x^2 - 1)$

(4) $y = x^7 \cdot 5^x$

(5) $y = \frac{2x - 3}{5x + 4}$

(6) $y = \log(x^4 \cdot e^x)$

OR

(a) Using the chain rule, find the derivative for the following functions : (any two) 6

(1) $y = (x^2 - 7x + 11)^8$

(2) $y = \sqrt{x^3 - x^2 - x - 1}$

(3) $y = 5^{x^2 + 3x + 1}$

(4) $y = e^{5-x+x^2}$

(b) If $y = x^3 \cdot \log\left(\frac{1}{x}\right)$ then prove that $x \cdot \frac{dy}{dx} + x^3 - 3y = 0$. 8

2. (a) Explain :

- (1) Marginal Cost
 - (2) Minimum value of a function
 - (3) Elasticity of demand
- (b) Find the maximum and the minimum value of $f(x) = x^3 + 3x^2 - 45x + 100.$

OR

(a) Explain :

- (1) Second derivative
 - (2) Revenue Function
 - (3) Method for maximizing profit in case of monopoly
- (b) (1) If $y = e^{3x} + e^{-3x}$ then prove that $\frac{d^2y}{dx^2} = 9y.$
- (2) The demand function is $p = 80 - 3\sqrt{x}$. Find the elasticity of demand when $x = 400.$

3. (a) State the meaning and uses of index number.

(b) Find Laspayer's, Paasche's and Fisher's index numbers from the following data :

| Item | 2018 | | 2020 | |
|------|--------------|---------------------|--------------|---------------------|
| | Price (₹) | Quantity (Units) | Price (₹) | Quantity (Units) |
| A | 5 | 6 | 6 | 8 |
| B | 3 | 8 | 2 | 10 |
| C | 2 | 12 | 4 | 10 |
| D | 8 | 2 | 7 | 2 |
| E | 9 | 5 | 9 | 6 |

OR

(a) What is meant by cost of living index number ? Write about the important points for the construction of it.

- (b) (1) Convert the following index numbers of fixed base method into the chain base method : 8

| Year | 2011 | 2012 | 2013 | 2014 | 2015 | 2016 |
|-----------------------------|------|------|------|------|------|------|
| Index numbers by fixed base | 100 | 120 | 125 | 140 | 175 | 200 |

- (2) Find the index number by the family budget method :

| Item | Base Year | | Current year |
|------|-----------|-------|--------------|
| | Quantity | Price | Price |
| P | 50 | 12 | 15 |
| Q | 7 | 25 | 35 |
| R | 15 | 80 | 90 |
| S | 20 | 65 | 90 |
| T | 3 | 120 | 150 |

4. (a) What is meant by a time series ? Also write its uses. 6

- (b) Find the trend and short term variations by using three yearly moving average method. 8

| Year | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | 2010 |
|--------|------|------|------|------|------|------|------|------|------|------|
| Series | 75 | 60 | 55 | 59 | 85 | 60 | 67 | 80 | 90 | 96 |

OR

- (a) What is meant by analysis of time series ? Explain its components. 6

- (b) Find the seasonal indices from the following data : 8

| Year | Jan.-Feb. | Mar.-April | May-June | July-Aug. | Sept.-Oct. | Nov.-Dec. |
|------|-----------|------------|----------|-----------|------------|-----------|
| 2018 | 52 | 60 | 65 | 70 | 80 | 88 |
| 2019 | 58 | 64 | 70 | 78 | 84 | 90 |
| 2020 | 60 | 65 | 74 | 80 | 89 | 94 |
| 2021 | 40 | 48 | 52 | 56 | 60 | 65 |
| 2022 | 45 | 50 | 56 | 60 | 64 | 70 |

5. Do as directed. (any seven)

- (1) Find $\frac{dy}{dx}$ if $y = a^x + e^x + a^e + e^a$.
 - (2) Find $\frac{d^2y}{dx^2}$ if $y = \log x$.
 - (3) The total cost function is $C = 2x^3 + x^2 + 11x + 150$. Find the marginal cost function and average cost function.
 - (4) Find $\frac{dy}{dx}$ if $x + y = 2x - y$.
 - (5) Write the sufficient condition for the maximum and the minimum value of a function.
 - (6) The price of a commodity is increased by three times in the current year as compare to the base year. What is the index number of the current year ?
 - (7) Write the formulae for Dorbish-Bowley and Marshall-Edgeworth index numbers.
 - (8) The index numbers by Paasche and Dorbish-Bowley method are 165 and 145 respectively. Find the index number by Laspaler's method.
 - (9) With which component of time series, will you associate the following events ?
 - (i) Increase in the demand of Oxygen due to Corona.
 - (ii) Income during weekend to a restaurant owner.
 - (10) The three among four seasonal indices of the quarters of a year are 85, 110 and 125. Find the seasonal indices of the fourth quarter.
 - (11) What are the periods of reoccurrence of the seasonal and cyclical variations ?
 - (12) Write the formula indicating the relationship between average revenue, marginal revenue and elasticity of demand.
-